

**ગુજરાત કેન્સર અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ**  
**(એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ)**  
**અમદાવાદ**

**તપાસ-સારવાર ની ફીમાં રાહત મેળવવા/કેશલેસ સારવાર મેળવવા**

૧. મુખ્યમંત્રી અમૃતમ યોજના (MA YOJANA) ના કાર્ડધારક તથા તે કાર્ડમાં સ્માવિષ્ટ કુટુંબના સભ્યોને અત્રેની હોસ્પિટલમાં તપાસ-સારવારમાં માફી આપવામાં આવશે.
૨. આયુષમાન ભારત પ્રધાનમંત્રી-જન આરોગ્ય યોજના (PM-JAY)નાં કાર્ડધારક તથા તે કાર્ડમાં સમાવિષ્ટ કુટુંબનાં સભ્યોને અત્રેની હોસ્પિટલમાં તમામ સારવારમાં માફી આપવામાં આવશે.
૩. અનુ.જાતિ (SC) ના દર્દીઓને જાતિનું પ્રમાણપત્ર સમાજ કલ્યાણ અધિકારી/મામલતદાર/ટી.ડી.ઓ. નું તથા આવકનું પ્રમાણપત્ર મામલતદાર/ટી.ડી.ઓ./ક્લેક્ટર ઓફીસના સક્ષમ અધિકારીનું રજૂ કરવું.
૪. અનુ.જન જાતિ (ST)ના દર્દીઓએ જાતિનું પ્રમાણપત્ર સમાજકલ્યાણ અધિકારી મામલતદાર/ટી.ડી.ઓ. ઓફીસના સક્ષમ અધિકારીનું રજૂ કરવું.
૫. ગુજરાત સરકારશ્રીના સરકારી કર્મચારીઓએ સર્વિસ અંગેનું તથા તેઓના આશ્રીતો (ફેમેલી મેમ્બર્સ) માટે તેઓશ્રી ઉપર આશ્રીત છે તેવું પ્રમાણપત્ર તેઓની કચેરીથી જાવક નંબર,રાઉન્ડ સ્ટેમ્પ તથા અધિકૃત અધિકારીના સહી સિક્કાવાળું રજૂ કરવું.
૬. ગુજરાત સરકારશ્રીના પેન્શનર તથા તેઓશ્રીના પતિ/પત્ની માટે પેન્શનનો ઓર્ડર/પેન્શન બુક રજૂ કરવી.
૭. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ રાહત મેળવવા સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ રાહત/માફીનો પત્ર,અન્ય પુરાવા સાથે રજૂ કરવા.
૮. ફીડમ ફાઈટરે તેઓનું આઈડેન્ટિટી કાર્ડ રજૂ કરવું.
૯. એ.એસ.આઈ.એસ.ના દર્દીઓએ કેશલેસ સારવાર માટે રીફર ફોર્મ તથા લાયઝન ઓફીસર (રૂમ નં. ૭૦) સિવિલ હોસ્પિટલ ઓ.પી.આઈ.આઈ.ડી. માથી રીફર કરેલ કેસ રજૂ કરવા.
૧૦. કંડલા પોર્ટ ટ્રસ્ટ,ઈસરો,રેલ્વે,ઓ.એન.જી.સી. વગેરે જેના પોસ્ટ પેઈડની મંજૂરી હોય તેવાં કર્મચારીઓએ જરૂરી રીફર ફોર્મ તથા પ્રમાણપત્રો સાથે એકાઉન્ટ ઓફિસમાં એકાઉન્ટ ઓફિસરને મળવું.
૧૧. કેદી દર્દીઓ સાથે જેલ સુપ્રિટેન્ડેન્ટનો સારવાર માટેનો ભલામણ પત્ર લાવવો જરૂરી છે.
૧૨. મટી શકે તેવા કેન્સરના દર્દીઓને ઈન્ડિયન કેન્સર સોસાયટી તરફથી રૂ.૨,૫૦,૦૦૦/- સુધીની સહાય મળી શકે તેમ છે તે માટેની ભલામણ માટે આપશ્રીની સારવાર આપતાં ડોક્ટરશ્રીનો સંપર્ક કરવો.
૧૩. કુટુંબની વાર્ષિક આવક રૂ.૨,૦૦,૦૦૦/- (રૂ. બે લાખ) સુધીની હોય તેવા દર્દીઓને (૧) મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) /ક્લેક્ટર ઓફીસમાંથી આવકનો દાખલો તથા (૨) નમૂના પ્રમાણેનું એફીડિવિટ (નમૂનો નોટિસ બોર્ડ/માહિતી કેન્દ્ર ઉપર છે) રજૂ કર્યેથી સારવાર-તપાસમાં ૫૦% રાહત આપવામાં આવશે.
૧૪. ઉપર્યુક્તમાંથી કોઈપણ યોજના હેઠળ મફત સારવાર /સહાય મળવાપાત્ર ન હૂય અને દર્દીને સહાયની જરૂરિયાત હોય તો પ્રધાનમંત્રી/કેન્દ્રિય આરોગ્યમંત્રી સહાય યોજનામાં અરજી કરવી.(આ માટેનું અરજી ફોર્મ નવા કેસ કાઉન્ટર,ઓ.પી.ડી. ના સીસ્ટર રૂમમાંથી મળશે)અથવા ગરીબ દર્દી સહાય કેન્દ્ર રૂમ નં. ૬૮ માં મળવું.
૧૫. નવા કેસના પ્રથમ દિવસે જરૂરિયાતવાળા દર્દીઓ તેઓશ્રીની તપાસ-સારવાર, દવામાં માફી સારવાર લેતા યુનિટના સીનીયર ડોક્ટરશ્રીની કેસમાં ભલામણ લખાવીને ઓફીસમાં મળવું જેથી યોગ્ય માફી કરવામાં આવશે. ત્યારબાદ ફી રાહતની જરૂરી કાર્યવાહી અનુસરવાની રહેશે.